

# RAN-1905090103060002

LL. M. (Sem.-III) Examination April - 2026

Banking Law - II

Time: 3 Hours ]

[ Total Marks: 70

|                                                                                                                                                            |                                                                                                                                                                                                                                                                                                                                                                                 |                      |                      |                      |                      |                      |                      |
|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------------|----------------------|----------------------|----------------------|----------------------|----------------------|
| <p><b>સૂચના : / Instructions</b></p> <p>(1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.<br/>Fill up strictly the above details on your answer book.</p> | <p>Seat No.:</p> <table border="1"> <tr> <td><input type="text"/></td> <td><input type="text"/></td> <td><input type="text"/></td> <td><input type="text"/></td> <td><input type="text"/></td> <td><input type="text"/></td> </tr> </table> <div style="border: 1px solid black; height: 80px; margin-top: 10px;"></div> <p style="text-align: center;">Student's Signature</p> | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> |
| <input type="text"/>                                                                                                                                       | <input type="text"/>                                                                                                                                                                                                                                                                                                                                                            | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> | <input type="text"/> |                      |                      |

- Q. 1.** ભારતીય રિઝર્વ બેંકના સંગઠનાત્મક માળખાની ચર્ચા કરો. 14  
અથવા
- Q. 1.** ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એક્ટ, 1961 ના ઉદ્દેશ્યો અને કારણોની ચર્ચા કરો. 14
- Q. 2.** RBI ના ક્રેડિટ કંટ્રોલ, એક્સચેન્જ કંટ્રોલ અને બેંક રેટ પોલિસી જેવા કાર્યોની ચર્ચા કરો. 14  
અથવા
- Q. 2.** નાણાંકીય સ્થિરતા જાળવવા અને ડિપોઝિટરોના હિતોનું રક્ષણ કરવામાં બેંકિંગ નિયમન કાયદાની ભૂમિકાનું વિશ્લેષણ કરો. 14
- Q. 3.** ચુકવણી માટે ચેક રજૂ કરવાની પ્રક્રિયા અને ચેકના અનાદરના પરિણામો સમજાવો. 14  
અથવા
- Q. 3.** ભારતમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવામાં નાબાર્ડની ભૂમિકાની ચર્ચા કરો. તે કૃષિ પહેલને કેવી રીતે ટેકો આપે છે. 14
- Q. 4.** બેંકિંગ સિસ્ટમમાં SBI ના મહત્વ અને આર્થિક વિકાસમાં તેના યોગદાનની ચર્ચા કરો. 14  
અથવા
- Q. 4.** નોન-બેંકિંગ કંપનીઓ પર RBI ના નિયંત્રણની ચર્ચા કરો. 14
- Q. 5.** ટૂંક નોંધ લખો (કોઈપણ બે) 14
1. કેન્દ્રીય બેંકનો વિકાસ
  2. ક્રેડિટ નીતિ
  3. RBI ના સામાજિક ઉદ્દેશ્ય
  4. બેંકરના અધિકારો અને ફરજો

## ENGLISH VERSION

- Q. 1.** Discuss the organizational structure of Reserve Bank of India. **14**
- OR**
- Q. 1.** Discuss the objectives and reasons of deposit insurance corporation act, 1961 **14**
- Q. 2.** Discuss the functions like credit control, exchange control and bank rate policy of RBI **14**
- OR**
- Q. 2.** Analyze the role of banking regulation act in maintaining financial stability and protecting depositors' interests **14**
- Q. 3.** Explain the procedure for presenting a Cheque for payment and consequences of dishonor of Cheque.
- OR**
- Q. 3.** Discuss the role of NABARD in promoting rural development in India. How does it support agriculture initiatives **14**
- Q. 4.** Discuss the significance of SBI in the banking system and its contribution to economic development. **14**
- OR**
- Q. 4.** Discuss the control of RBI over non-banking companies. **14**
- Q. 5.** **Write short notes (Any Two)** **14**
1. Evolution of central bank
  2. Credit policy
  3. Social objective of RBI
  4. Rights and duties of banker
-